



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૭/૨૦૧૯ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૧૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૮ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૧૯૬ લીટર દેશી દારૂ અને ૦૨ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી, ૧૧ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૯,૨૭૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૧૧૭/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૬૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૧૧૮/૧૯

ગુજરાત યુનિવર્સિટી : કૃષ્ણભગવાનભાઈ રાજારામ શર્મા (ઉ.વ.૭૦)(રહે,પુરુષોત્તમ બંગલો નંબર-૨ સિન્ધુભવન થલતેજ રોડ) એ તા.૩/૭/૧૯ નારોજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને-૨૦૧૨ થી આજદીન સુધીના સમયગાળા દરમિયાન આરોપી (૧) શ્રીકૃષ્ણા વિઠ્ઠલરાવ નિકમ (૨) રાજશ્રી વા/ઓ શ્રીકૃષ્ણા વિઠ્ઠલરાવ નિકમ (બંને રહે.અપ્રેમ સોસાયટી, પ્લોટ નંબર-૧૪૫, સેક્ટર-૧૨, વાસી, નવી મુંબઈ (૩)સંજીવ નાગભુષણમ સામલા (૪) નીતુ વા/ઓ સંજીવ સામલા (બંને રહે.કલ્પતરુ ગાર્ડન, અશોકનગર, કાંદીવલી ઇસ્ટ, મુંબઈ) નાઓએ ભેગામળી કૃષ્ણભગવાનભાઈ કંપનીમાં ૪૩% ના શેર હોલ્ડર હોવા છતાં કંપનીમાં રોકાણ કરેલ રકમ રૂપિયા ૨૬,૩૦,૭૨૦/- તથા નફાની રકમ મળી કુલ રૂપિયા ૩૬,૦૦,૦૦૦/- પૈકી ફક્ત રૂપિયા ૧,૦૦,૦૦૦/- પરત આપી બાકીની રકમ કુલ રૂપિયા ૩૫,૦૦,૦૦૦/- નહી આપી, કૃષ્ણભગવાનભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડી.કે.ઠાકોર ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૧૧૧૯/૧૯

બાપુનગર : હૈદરઅલી રહેમતુલ્લા શેખ (ઉ.વ.૪૨)(રહે.અંસારનગર લાકડાના પીઠાની બાજુમા સુંદરમનગર બાપુનગર) એ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૧/૦૭/૧૯ ના કલાક ૧૦/૦૦ થી તા.૦૩/૦૭/૧૯ બપોરના ૧૨/૩૦ વાગ્યા દરમિયાન બાપુનગર સોનીની ચાલીની બાજુમા શાંતિનગર બીજા માળે આવેલ હૈદરઅલીના ભાઈના મકાન નંબર-૧૦૯ ના દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એસ.દેસાઈ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૧૨૦/૧૯

નારોલ : અનીશએહમદ મોહમદહનીફ અંસારી (રહે.મરઝાન રેસીડન્સી કુબા મસ્જીદની પાસે વટવા કેનાલ રોડ નારોલ) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૨/૦૭/૨૦૧૯ રાતના ૧૦/૦૦ થી તા.૦૩/૦૭/૧૯ ના કલાક ૮/૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન નારોલ આકૃતી ટાઉનશીપની પાછળ આશીયાનાનગર ખાતે આવેલ પોતાના “અક્ષા ગારમેન્ટ” ના ગોડાઉનમાં કારીગરો અંદર સુતેલ હતા દરમ્યાન ગોડાઉનના મુખ્ય દરવાજાનું શટર ખોલી, અજાણી વ્યક્તિ અંદર પ્રવેશ કરી (૧) જે.ડી.કોર્પ. ન્યુ ક્લોથ માર્કેટના ૯૦૦ મીટરના ૧૨ રોલ શર્ટ બનાવાનું કાપડ કુલ કિંમત રૂપિયા આશરે ૧,૨૫,૦૦૦/- તથા (૨) હોલી સ્ટ્રીક ક્રીએશનના ૨૦ મીટરના ૫ ટાંકા કાપડના રોલ કિંમત રૂપિયા આશરે ૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૪૦,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.આર.આમલીયાર ચલાવે છે.

અપમૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૧૨૧/૧૯

વટવા જી.આઇ.ડી.સી. : મહેન્દ્રભાઇ ધુળાજી મેણા (ઉ.વ.૧૯)(રહે.કામધેનુ ઉદ્યોગ કંપનીમાં પ્લોટ નંબર-૨૯૧૩ ફેઝ-૪ જીઆઇડીસી વટવા) તા.૦૩/૦૭/૧૯ સવારના કલાક ૯/૦૦ વાગ્યાના સુમારે કામધેનુ ઉદ્યોગ કંપનીમાં લોખંડના પતરાના રોલ કરવાના પતરાનો ટુકડો ઉડેલ અને મહેન્દ્રભાઇ ને છાતીના ભાગે ઇજા થતા નીચે પડી જતાં ઇજાઓ થતા સારવાર અર્થે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન કલાક ૧૦/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે વટવા જી.આઇ.ડી.સી. પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.સી.જાડેજા ચલાવે છે.

વિજ કરંટ લાગતા મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૧૨૨/૧૯

એલીસબ્રીજ : જશીબેન વા/ઓ પરષોત્તમભાઇ ઠાકોર (ઉ.વ.૪૦)(રહે.ભુદરપુરા આંબાવાડી) નાઓને તા.૦૩/૦૭/૧૯ ના કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઇલેક્ટ્રીક શોટ લાગતા સારવાર માટે તેમને SVP હોસ્પિટલ ખાતે લઇ જતાં કલાક ૮/૨૦ વાગે ફરજ પરના ડો.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રતનસિંહ હિમ્મતસિંહ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૧૨૩/૧૯

અમરાઇવાડી : કાન્તિભાઈ જેઠાભાઈ સોલકી (ઉ.વ.૬૩)(રહે.અમરાઇવાડી) એ અગમ્ય કારણસર તા.૦૩/૦૭/૧૯ ના કલાક ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળે દુપટ્ટે બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી રમેશચંદ્ર સામંતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.